

SARDAR PATEL UNIVERSITY
TY BCom. (V SEMESTER) EXAMINATION

2012

Tuesday, 4th December

2.30 p.m. to 4.30 p.m.

UB05ECOM11 : ADVANCED BANKING - IX

Total Marks : 60

Q.1 Write notes :

(A) Fraud by Customers to the Banks. [07]

(B) Fraud by Banks to the Customers. [08]

OR

Q.1 Write notes on :

(A) Remedy to prevent fraud in Banks. [07]

(B) Statistical information of Bank Fraud. [08]

Q.2

(A) Reasons for cheque dishonour [05]

(B) Types of Crossing [05]

(C) Types of Negotiable instruments [05]

OR

Q.2 Explain with Drawing :

(A) Clean drawing of e-cheque [07]

(B) Meaning of Draft and its drawing [08]

Q.3

(A) Draw the figure of Bill of Exchange and explain its importance. [08]

(B) Explain in detail: e-cheque. [07]

OR

Q.3

(A) Which law is popular for consumer protection ? Explain in detail. [10]

(B) Discuss the limitations of Indian Bank Customers. [05]

Q.4

(A) Benefits of e-banking in India. [08]

(B) Demerits of e-banking in India. [07]

OR

Q.4 Match the following :

- | | |
|----------------------|----------------------|
| 1. Cheque | 1. Money Market |
| 2. 1986 | 2. Long term lending |
| 3. Bills | 3. Endorsement |
| 4. Development Banks | 4. Sec. 6 |
| 5. Sec. 138 | 5. Cheque |
| 6. Line on Cheque | 6. Debtors-Creditors |
| 7. 15 Digit | 7. C.P.A. |
| 8. Promissory Notes | 8. Bank fraud |



SARDAR PATEL UNIVERSITY
TY BCom. (V SEMESTER) EXAMINATION
2012
Tuesday, 4th December
2.30 p.m. to 4.30 p.m.
UB05ECOM11 : ADVANCED BANKING - IX

કુલ ગુણ : ૬૦

પ્ર.૧ નોંધ લખો.

- અ) બેંકોમાં ગ્રાહક દ્વારા થતી છેતરપિંડી. (૦૭)
બ) બેંકો દ્વારા ગ્રાહકોની છેતરપિંડી. (૦૮)

અથવા

પ્ર.૧ નોંધ લખો.

- અ) બેંકોમાં છેતરપિંડી અટકાવવાના ઉપાયો. (૦૭)
બ) બેંક છેતરપિંડીની આંકડાકિય માહિતી. (૦૮)

પ્ર.૨

- અ) ચેકની અસ્વીકૃતિના કારણો આપો. (૦૫)
બ) ચેક છેદાંકનના પ્રકારો. (૦૫)
ક) શાખી સાધનોના પ્રકારો. (૦૫)

અથવા

પ્ર.૨ આકૃતિ દોરી સમજાવો.

- અ) ઇ-ચેકની સ્વચ્છ આકૃતિ દોરો. (૦૭)
બ) ડ્રાફ્ટનો અર્થ અને આકૃતિ. (૦૮)

પ્ર.૩

- અ) વિનિમય પત્રની આકૃતિ દોરી તેની ઉપયોગિતા સમજાવો. (૦૮)
બ) ઇ-ચેકને વિસ્તૃત રીતે સમજાવો. (૦૭)

અથવા

પ્ર.૩

- અ) ગ્રાહકોની સુરક્ષા માટે કયો કાયદો લોકપ્રિય છે. વિગતે છણાવટ કરો. (૧૦)
બ) ભારતના બેંક ગ્રાહકોની મર્યાદા ચર્ચો. (૦૫)

પ્ર.૪

- અ) ભારતમાં ઇ-બેંકીંગના લાભો. (૦૮)
બ) ભારતમાં ઇ-બેંકીંગના ગેરલાભો. (૦૭)

અથવા

પ્ર.૪ જોડકા જોડો.

- | | |
|-----------------|------------------------|
| ૧. ચેક | ૧. નાણા બજાર |
| ૨. ૧૯૮૬ | ૨. લાંબા ગાળાનું ધિરાણ |
| ૩. ફંડી | ૩. છેદાંકન |
| ૪. વિકાસ બેંકો | ૪. કલમ-૬ |
| ૫. કલમ-૧૩૮ | ૫. ચેક |
| ૬. ચેક ઉપર લિટી | ૬. દેવાદાર-લેણદાર |
| ૭. ૧૫ ડિઝીટ | ૭. સી.પી.એ. |
| ૮. વચન ચિઝી | ૮. બેંક છેતરપિંડી |

